

પ્રિય માતા-પિતા / વાલી:

તમામ સાંસ્કૃતિક અને ભાષાકીય પૃષ્ઠાદભૂના પરિવારોનું મેન સ્વાગત કરે છે. એક કરતાં વધુ ભાષા બોલવી એ મૂલ્યવાન સંપત્તિ છે, અને અમે અંગ્રેજી શીખતી વખતે પરિવારોને તેમની ભાષાને જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ અન્ય ભાષા બોલે છે અથવા સમજે છે તેઓ મેનના પડકારરૂપ શૈક્ષણિક ધોરણોને પહોંચી વળવા માટે તેમની અંગ્રેજીને સુધારવા માટે સમર્થન મેળવી શકે છે. પ્રી-કિન્ડરગાર્ટનથી ગ્રેડ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે નીચેના પ્રશ્નો, તમારી શાળાને તે નિર્ધારિત કરવામાં મદદ કરશે કે તમારું બાળક અંગ્રેજી ભાષા સહાય સેવાઓનો લાભ લઈ શકે છે કે નહિ.

- જો અંગ્રેજી કરતાં અન્ય ભાષા દર્શાવેલ હોય, તો તમારા બાળકને અંગ્રેજી ભાષા સ્કિનર આપવામાં આવશે.
- તમારા બાળકના સ્કોરને આધારે, તમારા બાળકને અંગ્રેજી શીખનાર તરીકે વર્ગીકૃત કરી શકાય છે અને અંગ્રેજી ભાષા માટે સમર્થન પ્રાપ્ત કરવા યોગ્ય ગણી શકાય છે.
- જો તમે આ પત્ર અને નીચે આપેલા સર્વેક્ષણને બીજી ભાષામાં મેળાવવામાં માંગતા હો, અથવા જો તમે કોઈ દુભાષિયાને ઈચ્છો છો તો, તમારી શાળા તે વિનંતીઓ પૂરી કરશે.
- જો તમને આ સર્વેક્ષણ વિશે પ્રશ્નો હોય, તો કૃપા કરીને તમારી શાળાના પ્રિન્સીપાલનો સંપર્ક કરો.

ખાતરી રાખો કે તમારા જવાબો ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે જ ઉપયોગમાં લેવાશે. પૂર્ણ કરેલ સર્વેક્ષણ તમારા વિદ્યાર્થીની કાયમી ફાઈલમાં રાખવામાં આવશે, અને ફક્ત શાળા કર્મચારીઓને તેનો અક્સેસ હશે. કોઈ સ્કૂલ કર્મચારી તમારા પરિવારના કોઈ પણ સભ્યના ઈમિગ્રેશન સ્ટેટસ વિશે પૂછપરછ કરી શકશે નહીં.

આ માહિતી પૂરી પાડવા બદલ આપનો આભાર, અને હું તમારા વિદ્યાર્થીની ઉચ્ચ શૈક્ષણિક સફળતા ઈચ્છું છું.

આપની નિષ્ઠાવાન,

April Perkins

ESOL અને દ્વિભાષી કાર્યક્રમોના નિયામક, મેન શિક્ષણ વિભાગ

ભાષા ઉપયોગનો સર્વેક્ષણ

વિદ્યાર્થીનું નામ: _____

જન્મ તારીખ: _____

શાળા: _____

અપેક્ષિત ગ્રેડ: _____

કૃપા કરીને કોઈ પ્રશ્નને અનુત્તરિત ન છોડો.

- તમારું બાળક પ્રથમ કઈ ભાષા(ઓ) બોલી શકે સમજી શકે છે?
- તમારું બાળક પ્રથમ કઈ ભાષા(ઓ) બહુ સહેલાઈથી બોલી શકે સમજી શકે છે?
- તમારું બાળક સાથે લોકો દરરોજ કઈ ભાષામાં વાતચીત કરે છે?

માતા-પિતા/ વાલી ના હસ્તાક્ષર: _____

તારીખ: _____

ફક્ત શાળાના ઉપયોગ માટે

નોંધણી-પછીની ઓળખ: જો આ સર્વેક્ષણ પર માતાપિતા/પાલક દ્વારા અંગ્રેજી સિવાયની કોઈપણ ભાષા દર્શાવવામાં આવતી નથી, તો અંગ્રેજી ભાષાના સ્કિનર માત્ર ત્યારે જ મેળવી શકાય છે જો શિક્ષક દ્વારા આ વિભાગને પૂર્ણ કરવામાં આવ્યું હોય.

આ બાબતનો પુરાવો આપો કે વિદ્યાર્થીની અંગ્રેજી ભાષાનો વિકાસ અંગ્રેજી સિવાયની કોઈપણ પ્રાથમિક અથવા માતૃભાષાથી પ્રભાવિત છે:

શિક્ષકની સહી: _____

તારીખ: _____

આ પૂર્ણ દસ્તાવેજની મૂળ નકલને વિદ્યાર્થીના કાયમી રેકોર્ડ ફોલ્ડરમાં મૂકો